

તા. ૦૧/૦૭/૨૦૧૯ ના રોજ એમ.ફીલ તથા પી.એચ.ડી.ની પ્રવેશ કાર્યવાહી બાબતની મળેલ મીટીંગની કાર્યવાહી નોંધ

- એમ.ફીલ તથા પી.એચ.ડી. પીન વિતરણ ગુજરાત યુનીવર્સિટી સેન્ટ્રલ કન્ઝ્યુમર કો.ઓ. સ્ટોર લીમીટેડ, યુનિ. ભાષા ભવન સામે, ગુજરાત યુનીવર્સિટી કેમ્પસ, અમદાવાદ - ૩૮૦૦૦૯ માંથી તા. ૦૪/૦૭/૨૦૧૯ થી ૧૩/૦૭/૨૦૧૯ સુધી (રજાના દિવસ સિવાય) સવારે ૧૧:૦૦ થી બપોરે ૩:૦૦ વાગ્યા સુધી મળશે.
- તા.૦૫/૦૭/૨૦૧૯ થી તા. ૧૫/૦૭/૨૦૧૯ સુધી ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે તથા તા.૦૫/૦૭/૨૦૧૯ થી જરૂરી દસ્તાવેજો સાથે હાર્ડ કોપી તા. ૧૬/૦૭/૨૦૧૯ નાં બપોરના ૨:૦૦ વાગ્યા સુધી જે તે સંબંધિત વિભાગમાં જમા કરાવવાની રહેશે અથવા જે તે સંબંધિત વિભાગ સવારની પાળીમાં ચાલે છે ત્યાં બપોરના ૧:૦૦ વાગ્યા સુધી જમા કરાવવાના રહેશે એટલે કે શિક્ષણ વિભાગ, લો ભવન, જર્નાલિઝમ વિભાગનો સમય સવારે ૮:૦૦ થી ૧:૦૦ વાગ્યા સુધીનો રહેશે.
- તા. ૧૮/૦૭/૨૦૧૯ સુધીમાં એલીજબલ વિદ્યાર્થીઓનું લીસ્ટ મૂકવાનું રહેશે તથા તે લીસ્ટ પરત્વે કોઈ ક્વેરી હોય તો વિદ્યાર્થીઓએ તા. ૧૯/૦૭/૨૦૧૯ ઓફિસ સમય દરમિયાન ક્વેરી જે તે વિભાગના ધ્યાનમાં લાવવાની રહેશે.
- તા. ૨૦/૦૭/૨૦૧૯ નાં રોજ ફાઈનલ એલીજબલ વિદ્યાર્થીઓનું લીસ્ટ જાહેર કરવામાં આવશે.
- તા. ૧૮/૦૭/૨૦૧૯ સુધીમાં એમ.ફીલ./પી.એચ.ડી. નાં પ્રશ્નપત્રો પી.જી. વિભાગમાં જમા કરાવવાના રહેશે.
- એમ.ફીલ. તથા પી.એચ.ડી. માટે આ મુજબનું હેતુલક્ષી (MCQ) પ્રકારનું પ્રશ્નસ્વરૂપ રહેશે:

ક્રમ.	વિદ્યાશાખા	કુલ પ્રશ્નો	સામાન્ય અભ્યાસ (પ્રશ્ન નં. ૧ થી ૫૦)	વિષયને આનુષંગિક (પ્રશ્ન નં. ૫૧ થી ૧૦૦)
૧.	એમ.ફીલ.	૧૦૦	૫૦	૫૦
૨.	પી.એચ.ડી.	૧૦૦	૫૦	૫૦

- પ્રવેશ પરીક્ષામાં નેગેટીવ માર્કિંગ રહેશે નહિ. સામાન્ય અભ્યાસના પરીક્ષાના પ્રશ્નોનું માધ્યમ ગુજરાતી તથા અંગ્રેજી રહેશે. ભાષા વિષયને આનુષંગિક પરીક્ષાના પ્રશ્નોનું માધ્યમ જે તે ભાષા વિષયાનુસાર રહેશે. વિનયન વિદ્યાશાખામાં વિષયને આનુષંગિક પરીક્ષાના પ્રશ્નોનું માધ્યમ ગુજરાતી તથા અંગ્રેજી રહેશે. જ્યારે અન્ય વિષયોના પ્રશ્નપત્રો અંગ્રેજી માધ્યમમાં રહેશે.
- તા. ૨૭/૦૭/૨૦૧૯ ના રોજ સવારે ૧૧:૦૦ થી ૦૧:૦૦ એમ.ફીલ. પ્રવેશ પરીક્ષા તથા બપોરે ૦૩:૦૦ થી ૦૫:૦૦ પી.એચ.ડી. પ્રવેશ પરીક્ષા વિષય મુજબ જે તે વિભાગમાં યોજવાની રહેશે.
- એમ.ફીલ. તથા પી.એચ.ડી. અંગેની એડમીશન કમિટી, જીડીપીઆઈ શક્ય હોય તો આર.ડી.સી. સાથે તા. ૧૪.૦૮.૨૦૧૯ સુધી અને અમુક સંજોગોમાં આર.ડી.સી. તા. ૩૦.૦૮.૨૦૧૯ સુધી યોજવાની રહેશે.
- પી.એચ.ડી. માટે પ્રથમ સત્ર માટે તા. ૩૧.૦૮.૨૦૧૯ તથા બીજા સત્ર માટે તા. ૩૧.૦૧.૨૦૨૦ સુધીમાં તમામ કાર્યવાહી પૂરી કરવાની રહેશે તથા રજીસ્ટ્રેશન અંગે પી.જી. વિભાગમાં તાત્કાલિક રજીસ્ટ્રેશન ફોર્મ બિડાણો સહીત આર.ડી.સી. ના રીપોર્ટ સાથે મોકલવાના રહેશે.
- અન્ય યુનીવર્સિટીના વિદ્યાર્થીઓએ પ્રવેશ પરીક્ષા પાસ કાર્ય બાદ દિન-૭ માં પ્રોવિઝનલ એલીજબીલીટી સર્ટીફિકેટ મેળવી જે તે વિભાગમાં રજૂ કરવાનું રહેશે.